

### **08 November 2023**

To,
The Listing Department **BSE Limited**Phiroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai: 400 001

Ref: Script Code: 539384

Sub: Newspaper Publication: Un-Audited Financial Results for the Quarter Ended and Half Yearly Ended September 30, 2023.

Dear Sir / Madam,

As required under Regulation 47 of SEBI (LODR), Regulations, 2015, please find enclosed herewith newspaper advertisement Dated **08/11/2023** as published under the Companies Act, 2013 and rules made there under in Lok Mitra (Vernacular Language) and Freepress (English daily) in connection with the Un-Audited Financial Results for the Quarter and Half Year Ended **September 30, 2023.** 

Kindly take the same on record.

Thanking you,

Yours faithfully, For, Krishna Capital & Securities Limited

Ashokkumar Agrawal (Managing Director) (DIN 00944735)

## Daily average air quality in Delhi, for the 10-month period between January – October, 2023, establishes trend of relative improvement in air quality of Delhi-NCR



2019 and 157 in 2018 respectively. This period in 2023 has also witnessed a remarkable reduction in daily avg. PM2.5 and PM10 concentrations over the last 6 years. The period during January-Cotober in 2023 recorded a daily average PM2.5 concentration of about 75 µgm/m3 as against ranging from 217 to 2022 (barring the COVID affected 2020). Likewise, the daily average PM10 concentration WESTERN BUNYAREAJKOT DISSION The daily average air quality in Delhi, for the 10-month period between January – October, 2023, registers its best index as compared to the corresponding period during the last 6 years (barring the COVID affected 2020), thus establishing a continual trend of relative improvement in air quality of Delhi-NCR. The daily avg. AQI for Delhi during the

in Delhi has been about 1.73 μgm/m3, which is much lower than a range of 182-220 μgm/m3 during the corresponding periods from 2017 to 2022 (barring the COVID affected 2020). In wake of highly unfavourable meteorological and dimatic conditions prevailing around this point of time,

measures under GRAP Stage-II were invoked proactively on 21.10.2023 so as to intensify the preventive measures towards preventive measures towards endeavouring delayed invoking of Stage-III of the GRAP as much as possible. GRAP Stage-III in previous years was invoked in last week of October which has not been the case

during 2023. The Commission once again urges the stakeholders to effectively implement all directions / implement all directions / guidelines related to abatement of air pollution, particularly under the schedule of the GRAP and the citizens to follow the Citizen Charter in our joint pursuit for better air quality.

### **ANJANI SYNTHETICS LIMITED**

CIN: L1171IGJ1984PLC007048

d Office: 221 (Maliya), New Cloth Market, O/s. Raipur Gate, Ahmedabad- 380002, Guja EXTRACT OF STANDALONE UNAUDITED FINANCIAL RESULTS FOR SECOND QUARTER AND
HAIF YEAR ENDED ON 30TH SEPTEMBER 2023

(Rs. In Lakhs except EPS)										
PARTICULARS	Quarter ended on 30.09.2023 (unaudited)	Half Year ended on 30.09.2023 (unaudited)	Corresponding 3 months ended in the previous year 30.09.2022 (unaudited)	Year ended 31.03.2023 (Audited)						
Total Income from Operations	7283.96	13167.89	8238.95	33020.19						
Net profit/(Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	119.99	216.85	90.92	461.92						
Net profit/(Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	119.99	216.85	90.92	461.92						
Net profit/(loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	89.76	161.17	67.57	348.21						
Total Comprehensive Income for the period (Comprising Profit/(loss) for the period (after tax) and other comprehensive Income (after tax)	89.76	161.17	67.57	408.19						
Paid-up equity Share Capital	1475.00	1475.00	1475.00	1475.00						
Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited Balance Sheet of the previous year	-		-	6413.86						
Earnings per Share (of Rs. 10/- each) (for continuing operations)  -Basic	0.61	1.09	0.46	2.36						

## GOKUL AGRO RESOURCES LIMITED

## EXTRACT OF UNAUDITED CONSOLIDATED FINANCIAL RESULTS FOR THE QUARTER AND

quality of Delhi-NCR. The daily	ranging	g from 81-95 µgm/m3	(after Exceptional and/or Extraordinary ite	ms) 119.99	216.85 90	.92
avg. AQI for Delhi during the		the corresponding	Net profit/(loss) for the period after tax (a	ifter 89.76	161.17 67	.57 348.21
above noted period during the		s from 2017 to 2022	Exceptional and/or Extraordinary items) Total Comprehensive Income for the period		101117	
current year has been		g the COVID affected	(Comprising Profit/(loss) for the period (at	fter en 76	161.17 67	57 408.19
recorded as 172 against 187		Likewise, the daily	tax) and other comprehensive Income (af- tax)	ter 05.70	101.17	
in 2022, 179 in 2021, 156 in		e PM10 concentration	Paid-up equity Share Capital	1475.00	1475.00 147	5.00 1475.00
			Reserves (excluding Revaluation Reserve) shown in the Audited Balance Sheet of the	as		6413.86
2020, 193 in 2019 and 201 in		N RAILWAY-RAJKOT DIVISION	previous year		.	6413.86
2018 respectively, during the		MODIFICATION WORK	Earnings per Share (of Rs. 10/- each) (for	0.61	1.09 0	46 2.36
corresponding period. AQI	Tender	Notice No. DRM/RJT/E-	continuing operations) -Basic			
levels are greatly impacted by	Dt 31 10	/EL/TRD/2023-2024/18 2023 Address of the office:	-Diluted			
the levels of rainfall/	Divisio	nal Railway Manager	Notes:			
precipitation and wind speed	(Electri	cal/ Traction), Western	<ol> <li>The above is an extract of the detail the stock exchange under Regulation</li> </ol>	led format of Second quarte	r and Half Year ended Unaudit	ed Financial Results filed with
which are prime facilitators for		Kothi Compound, Rajkot- Website particulars:	format of the unaudited Financi			
dispersal of the pollutants /	www.ire	ps.gov.in Tender No: DRM-	www.anjanisynthetics.com			
emissions. Effective dispersal		TRD-2023-24-18 (i) Name of	<ol><li>The above financial results have b</li></ol>	een reviewed by the Audit	Committee and approved by	the Board of Directors in the
is a must for a good air quality,	work :	OHE Modification work in on with Provision of 12m FOB at	meeting held on 07th November, 20 3. The company has adopted Indian A		S") notified by the Ministry o	f Cornorate Affairs with effect
even if there is a control /		Station of Rajkot Division. (ii)	from 1st April, 2017.Accordingly the	Financial Result for the Se	cond Quarter and half year en	ided on 30th September,2023
reduction in the quantum of	Approx.	cost: ₹ 95,21,051.26/- (iii)	in accordance with IND-AS and other	er accounting principles gen	erally accepted in India.	
emissions from all the primary	Earnest	Money: ₹ 1,90,400/- (iv) Time for Online apply: On			For	, Anjani Synthetics Limited
sources in the region. Delhi	28.11.20	23 up to 15.00 Hours. 100	Place : Ahmedabad			Vasudev S. Agarwal (Managing Director)
recorded a single day scant		f facebook.com/WesternRly	Date : 07-11-2023			(DIN-01491403)
rainfall of only 5.4 mm in the						, , , , , , ,
month of October, 2023 as		COKI	IL AGRO RESOL	IDCEC LIM	ITTED	
against 6 and 7 days of rainfall		GUKU	IL AGRO RESUL	JKCES LIIV	ココロレ	
during the month of October,			CIN- L15142GJ2014PI	LC080010		COKIII
2022 and October 2021, with		Registered	Office: Crown-3, Inspire Business Park,	Shantigram, Nr Vaishnoo	levi Circle,	anno resources ltd
a cumulative rainfall of			S.G. Highway, Khodiyar, Ahmedabad-	382421 Gujarat, India		agro resources itd
approximately 129 and 123		E-Mail ID:compliance	es@gokulagro.com; Tel No: +91 79	6/123500; Website: v	ww.gokulagro.com	
mm respectively during the		FXTRACT	OF UNAUDITED CONSOLIDATED F	FINANCIAL RESULTS	FOR THE QUARTER AND	)
month. The average wind			HALF YEAR ENDED ON	30TH SEPTEMBER, 20	122	in Lakhs except EPS)
speed during the month of				•	(17.5.	Corresponding
October, 2023 was also						3 months ended
					Year to date	
relatively clower and chells of						
relatively slower and spells of absolute "still" conditions were				Quarter Ended	Figures	in the previous
absolute "still" conditions were	SN	F	Particulars	Quarter Ended		in the previous year
absolute "still" conditions were also witnessed during the	SN	F	Particulars		Figures	year
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy	SN	F	Particulars	Quarter Ended  30th September,		-
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind	SN	F	Particulars		Figures	year
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI	SN	F	Particulars	30th September,	Figures  30th September,	year 30th September,
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October,	SN 1	Revenue from Opera		30th September, 2023	Figures  30th September, 2023  Unaudited	year  30th September, 2022 Unaudited
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been		Revenue from Opera	ations	30th September, 2023 Unaudited	Figures  30th September, 2023	year  30th September, 2022
absolute"still"conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily	1	Revenue from Opera	ations eriod	30th September, 2023 Unaudited 4,11,894.89	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27	year  30th September, 2022 Unaudited 2,77,506.10
absolute"still"conditions were also withessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during		Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except	ations	30th September, 2023 Unaudited	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27	year  30th September, 2022 Unaudited
absolute"still"conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also	1	Revenue from Opera	ations eriod	30th September, 2023 Unaudited 4,11,894.89	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27	year  30th September, 2022 Unaudited 2,77,506.10
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of	1	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except	ations eriod ional and/or Extraordinary	30th September, 2023 Unaudited 4,11,894.89	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27	year  30th September, 2022 Unaudited 2,77,506.10
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to	1	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe	ations eriod ional and/or Extraordinary eriod Before Tax	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27 7,463.57	year  30th September, 2022 Unaudited 2,77,506.10  3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily	1 2	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe	ations eriod ional and/or Extraordinary	30th September, 2023 Unaudited 4,11,894.89	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27 7,463.57	year  30th September, 2022 Unaudited 2,77,506.10
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI <200) during days (201) during	1 2	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27 7,463.57	year  30th September, 2022 Unaudited 2,77,506.10  3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily	1 2 3	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe	ations Priod Ional and/or Extraordinary Priod Before Tax Ind/or Extraordinary (tems)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	30th September, 2023 Unaudited 6,58,781.27 7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69
absolute "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January — October 2023 as compared to the	1 2	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptional	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	30th September, 2023 Unaudited 6,58,781.27 7,463.57	year  30th September, 2022 Unaudited 2,77,506.10  3,900.69
absolute "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January — October 2023 as compared to the	1 2 3	Revenue from Oper Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exception items)	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	30th September, 2023 Unaudited 6,58,781.27 7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January — October 2023 as compared to the corresponding period in the	1 2 3	Revenue from Opera Net Profit for the pc (Before Tax, Except items)  Net Profit for the pc (After Exceptional a  Net Profit for the pc (After Tax, Exceptional a)  Total Comprehensiv	ations  eriod  eriod Before Tax  nd/or Extraordinary items)  eriod  eriod eriod many items)  eriod  eriod eriod  eriod	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	30th September, 2023 Unaudited 6,58,781.27 7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the	3	Revenue from Opers Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit fe	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e Income for the period or the period (after tax)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70 4,317.70 3,379.4	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27  7,463.57  7,463.57  5,7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI-200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good"	1 2 3	Revenue from Opers Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit fe	ations  eriod  eriod Before Tax  nd/or Extraordinary items)  eriod  eriod eriod many items)  eriod  eriod eriod  eriod	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27  7,463.57  7,463.57  5,7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69
absolue "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days	3	Revenue from Opers Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit fe	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e Income for the period or the period (after tax)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70 4,317.70 3,379.4	Figures  30th September, 2023  Unaudited 6,58,781.27  7,463.57  7,463.57  5,7,463.57	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delih has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<-200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality dayduring this period in the	3 4 5	Revenue from Oper: Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit fi and Other Comprehe	artions erriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nonla nd/or Extraordinary e Income for the period or the period (after tax) ensive income (after tax)]	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.7 4,317.7 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolute "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low middle speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days during this period in the previous years were only 160	3	Revenue from Oper: Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit fi and Other Comprehe	ations eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e Income for the period or the period (after tax)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70 4,317.70 3,379.4	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	year 30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69
absolue "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delih has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<-200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality dayduring this period in the	3 4 5	Revenue from Opers Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit f and Other Comprehe	artions erriod fonal and/or Extraordinary erriod Before Tax nd/or Extraordinary items) erriod nal and/or Extraordinary e income for the period or the period (after tax) ensive income (after tax)] ( Face value of Rs.2/- each)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.7 4,317.7 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolute "still" conditions were also withressed during the month. Despite this freavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during the conservation of the daily avg. AQI of 210 during October, 2022. Delih ihas also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January — October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days during this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in	1 2 3 4 5	Revenue from Opers Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptio items) Total Comprehensiv [Comprising Profit for and Other Comprehe	eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e income for the period or the period (after tax) ensive income (after tax)] (Face value of Rs.2/- each) Revaluation Reserve) as	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.7 4,317.7 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolute "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during the Cotober, 2022. Delih ihas also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days during this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat	3 4 5	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exception items) Total Comprehensiv [Comprising Profit f, and Other Compreh	artions erriod fonal and/or Extraordinary erriod Before Tax nd/or Extraordinary items) erriod nal and/or Extraordinary e income for the period or the period (after tax) ensive income (after tax)] ( Face value of Rs.2/- each)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.7 4,317.7 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolue "still" conditions were also withessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality dayduring this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat Vidyapith	1 2 3 4 5	Revenue from Oper- Net Profit for the pi (Before Tax, Except items) Net Profit for the pi (After Exceptional a Net Profit for the pi (After Tax, Exceptio items) Total Comprehensiv (Comprising Profit fi and Other Comprehe	eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e Income for the period or the period (after tax) ensive Income (after tax)] (Face value of Rs.2/- each) Revaluation Reserve) as d Balance Sheet of the	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.7 4,317.7 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolue "still" conditions were also withessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality dayduring this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat Vidyapith	1 2 3 4 5	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptional a Net Profit for the pe items) Total Comprehensiv [Comprehensiv [Comprehensiv Equity Share Capital Reserves (excluding shown in the Audite previous year Earnings Per Share (	artions  eriod  ional and/or Extraordinary  eriod Before Tax  nd/or Extraordinary items)  eriod  artiod  eriod  ional and/or Extraordinary  e Income for the period  or the period (after tax)  ensive Income (after tax)]  I (Face value of Rs.2/- each)  Revaluation Reserve) as  d Balance Sheet of the  of Rs.2/each)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.74 4,317.74 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolue "still" conditions were also witnessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days during this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat Vidyapith playground row:	1 2 3 4 5	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptional a Net Profit for the pe items) Total Comprehensiv [Comprehensiv [Comprehensiv Equity Share Capital Reserves (excluding shown in the Audite previous year Earnings Per Share (	eriod ional and/or Extraordinary eriod Before Tax nd/or Extraordinary items) eriod nal and/or Extraordinary e Income for the period or the period (after tax) ensive Income (after tax)] (Face value of Rs.2/- each) Revaluation Reserve) as d Balance Sheet of the	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.74 4,317.74 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolue "still" conditions were also withessed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI<200) during January – October 2023 as compared to the corresponding period in the previous years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality dayduring this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat Vidyapith	1 2 3 4 5	Revenue from Opera Net Profit for the pe (Before Tax, Except items) Net Profit for the pe (After Exceptional a Net Profit for the pe (After Tax, Exceptional a Net Profit for the pe items) Total Comprehensiv [Comprehensiv [Comprehensiv Equity Share Capital Reserves (excluding shown in the Audite previous year Earnings Per Share (	artions  eriod  ional and/or Extraordinary  eriod Before Tax  nd/or Extraordinary items)  eriod  artiod  eriod  ional and/or Extraordinary  e Income for the period  or the period (after tax)  ensive Income (after tax)]  I (Face value of Rs.2/- each)  Revaluation Reserve) as  d Balance Sheet of the  of Rs.2/each)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.74 4,317.74 3,379.4:	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  5,784.18  7,5874.56	30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 3,900.69 2,948.08
absolute "still" conditions were also withressed during the month. Despite this heavy rainfall deficit and low wind speeds, the daily avg. AQI during the month of October, 2023 at 219 has only been slightly higher than the daily avg. AQI of 210 during October, 2022. Delhi has also witnessed highest number of days (206) with "Good" to "Moderate" air quality (Daily Average AQI < 200) during January – October 2023 as compared to the corresponding period in the previous, years (barring the COVID affected 2020). "Good" to "Moderate" air quality days during this period in the previous years were only 160 in 2022, 197 in 2021, 175 in Gujarat Vidyapith playground row:	1 2 3 4 5	Revenue from Oper: Net Profit for the pr (Before Tax, Except items) Net Profit for the pr (After Exceptional a Net Profit for the pr (After Tax, Exceptional a Comprehensiv [Comprising Profit for and Other Comprehe Equity Share Capital Reserves (excluding shown in the Audite previous year Earnings Per Share Earnings Per Share (for continuings and of	artions  eriod  ional and/or Extraordinary  eriod Before Tax  nd/or Extraordinary items)  eriod  artiod  eriod  ional and/or Extraordinary  e Income for the period  or the period (after tax)  ensive Income (after tax)]  I (Face value of Rs.2/- each)  Revaluation Reserve) as  d Balance Sheet of the  of Rs.2/each)	30th September, 2023 Unaudited 4,11,894.89 4,317.70 4,317.77 3,379.4: 3,436.39	Figures  30th September, 2023  Unaudited  6,58,781.27  7,463.57  7,463.57  5,784.18  5,874.56  7,2,950.87	year  30th September, 2022 Unaudited 2,77,506.10 3,900.69 2,948.08 3,278.29 2861.45

playground row:
Posters removed
Ahmedabad: The
controversy that had erupted
after the playground of Gujarat
Vidyapith was rented to a
private school to set up a
cricket academy gathered
steam on Saturday. The cricket
academy is to be inaugurated
on November 5, and a day
before that on Saturday, the
posters of the cricket
academy were removed.
Sources in the deemed
university said that the top
management is unaware who
rented this playground to a
private school. "The
playground used to be rented
for a few hours to private
institutes but never has been
glven on a lease," said a source.
The school has reportedly
given the playground or Ine school has reportedly given the playground on contract to a private contractor to start a cricket academy. The university administration came to know that the playground has been rented to a private school when they came to know of an invitation card of the launching of the academy. know of an invitation card of the launching of the academy by Shree Vidyanagar School. trin Private school operators in Gurgaon, India have been granted an extension to prepare for permanent recognition recognition.

Notes:
1. The aforesaid Financial Results have been reviewed by the Audit Committee a
2. Additional Information on Standalone Financial Results is as follo

(Rs In Lakhs) Corresponding 3 months ended in the previous Figures 2023 2023 2022 1 Revenue from Operations Turnover

Net Profit for the period
(Before Tax, Exceptional and/or Extraordinary 3.96.702.39 6,29,899,69 2,51,001,49 (After Exceptional and/or Extraordinary items) Net Profit for the period 4,485.58 (After Tax, Exceptional and/or Extraordinary 2,685,17 2,240.4 items)

For & on behalf of Board of Directors of Gokul Agro Resources Limited Sd/-Jayesh Thakkar Managing Diector (DIN: 03050068)

# BHATIA'S BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED CIN: 1.32109GJ2008PLC053336 Regd Off: 132, Dr. Ambedkar Shopping Cettre, Ring Road, Surat-395002 Webste: www.bhatlamobile.com, mail: info@bhatlamobile.com, Pri: 9727714477

SI. No.	Particulars	Quarter ended 30 <sup>th</sup> September 2023	Half Year ended 30 <sup>th</sup> September 2023	Quarter ended 30 <sup>th</sup> June 2023	Quarter ended 30 <sup>th</sup> September 2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations*	9435.582	19142.530	9706.948	7354.875
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	332.545	800.460	467.915	217.720
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	332.545	800.460	467.915	217.720
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	247.335	604.822	357.487	162.804
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax)]	247.884	605.921	358.036	163.549
6	Equity Share Capital	1251.520	1251.520	1251.520	1251.520
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited/Unaudited Balance Sheet of the previous year	-	-	-	-
8	Earnings Per Share (face value of Re. 1/- each) (for continuing and discontinued operations)	-	-	-	-
	1. Basic	0.198	0.483	0.286	0.130
	2. Diluted	0.198	0.483	0.286	0.130

ons & Retail (India) Limited Sd/-Sanjeev Harbanslal Bhatia Managing Director



	- 0	UARTER END		HALF YEAR ENDED		YEAR ENDE
PARTICULARS	30/09/2023	30/06/2023	30/09/2022	30/09/2023	30/09/2022	31/03/202
	(Unaudited)	(Unandited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Audited)
MONTH COVERED	3	3	3	6	6	12
Total Income From Operating Income	10.11	8.59	8.69	18.70	19.62	39.1
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.67	1.31	4.33	5.98	5.46	16.64
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4,67	1.31	4.33	5.98	5.46	16.6
Net Profit/(Loss) for the Period After Tex	3.51	0.98	3.25	4.49	4.10	14.0
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/floss) for the period (after Tax) and Other Comprehensive Income (After Tax)	3.51	0.98	3.25	4.49	4.10	14.0
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.11	0.03	0.10	0.14	0.13	0.4
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.11	0.03	0.10	0.14	0.13	0.4

ΙГ		9	UARTER END	ED	HALF YE	YEAR ENDED			
ш	PARTICULARS		30/06/2023	30/09/2022	30/09/2023	30/09/2022	31/03/2023		
ш		(Unsudited)	(Unsudited)	(Unsudited)	(Unsudited)	(Unsudited)	(Audited)		
ΙП	MONTH COVERED	3	3	3	- 6	6	12		
	stal Income From Operating Income	10.11	8.59	8.69	18.70	19.62	39.11		
N.	rt Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4,67	1.31	4.33	5.98	5.46	16.64		
	rt Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	2.64	1.16	4.44	3.80	4.69	17.58		
N	t Profit/(Loss) for the Period After Tax	1.98	0.87	3.33	2.85	3.52	14.83		
	tal Comprehensives Income For the Period (Comprehensing Profit/(Loss) for the period	1.98	0.87	3.33	2.85	3.52	14,83		
94	ter Tax) and Other Comprehensive Income (After Tax)	1.90	0.01	0.20	2.00	0.04			
	rid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84		
	sic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.06	0.03	0.11	0.09	0.11	0.47		
Di	luted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.06	0.03	0.11	0.09	0.11	0.47		

## **ZODIAC ENERGY LIMITED**

		(Rs. in	Lakh except EPS)
Particulars	Quarter ended on 30/09/2023	Quarter ended on 30/09/2022	Year ended on 31/03/2023
	Unaudited	Unaudited	Audited
Total Income From Operations	3445.47	2670.95	13849.62
Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	173.38	178.32	438.2
Net Profit/(Loss) for the period before tax ( after Exceptional and/or Extraordinary items)	173.38	178.32	438.2
Net Profit/(Loss) for the period after tax ( after Exceptional and/or Extraordinary items)	148.45	164.10	318.94
Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income (after tax)]		164.10	313.81
Equity Share Capital	1463.34	1463.34	1463.34
Reserves (excluding Revaluation Reserve as shown in the audited Balance Sheet of the previous year)			2,141.70
Earnings Per Share (of Rs 10/- each) (for continuing			
and discontinued operations)-			
Basic : (not annualzed for the quarter ended)	1.01	1.12	2.18
Diluted (not annualzed for the quarter ended)	1.01	1 12	2 18

Note: The above financial is an extract of the detailed format of quarterly Financial Results filed with the lational Stock Exchange of India Limited and BSE Limited under Regulation 33 of the SEBI (Listing Obligation as of the SEBI (Listing Obligation as of the SEBI (Listing Obligation as of the SEBI (Listing Obligation and Results are available on the Website of BSE Limited at www.bseindia.com, www.nseindia.com and Company's website as the Website of BSE Limited at www.bseindia.com, www.nseindia.com and Company's website as the Website of BSE Limited at www.bseindia.com (Application and Company's website as www.zodiacenergy.com).

.-sd--Kunjbihari Shah Managing Director(DIN: 00622460)

## સાયન્સ સિટીમાં આગામી સમયમાં નવા આકર્ષણો ઉમેરાશે

અમદાવાદમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી નિર્માણ थयेला सायन्त्र सिटीनी (स्तरोत्तर વધલા સાયન્સ સિટાના ઉત્તરાતર વધતી લોકપ્રિયતાના સંદર્ભમાં આગામી સમયમાં નવા ઇનોવેટિવ આકર્ષણો જોડવા માટેના આયોજનની

સમીક્ષા કરી હતી. વડાપ્રધાનશ્રીએ વિજ્ઞાન સાથે લોકસમુહને જોડવા અને બાળકો-યુવાઓ સૌ કોઈને મનોરંજન સાથે જ્ઞાન તથા નવા વૈજ્ઞાનિક શોધ-સંશોધનની જાણકારી એક જ સ્થળેથી મળી રહે તે માટે ૧૦૭ હેક્ટર વિસ્તારમાં આ વર્લ્ડક્લાસ સાયન્સ સિટીનું નિર્માણ ૨૦૦૧માં કરાવેલું છે. આ સાયન્સ સિટીએ વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે ખાસ કરીને બાળ વિદ્યાર્થીઓમાં અનેરું આકર્ષણ અને જિજ્ઞાસા જગાવ્યા છે.

સાયન્સ સિટીમાં વિવિધ ગેલેરીઝ અને પાર્કસ ઉભા કરીને ટેકનોલોજી યુક્ત અભિગમ સાથે લોકોમાં વિજ્ઞાન પ્રત્યે રસ-રૂચિ વધે અને ગમ્મત સાથે જ્ઞાન વર્ધન થાય તેવો અભિગમ

રાખવામાં આવ્યો છે. દર વર્ષે એક-એક નવીન ગેલેરી સાયન્સ સિટીમાં નિર્માણ કરવામાં

ત્તા. આ સાયન્સ સિટીમાં હાલ મ્યુઝિકલ ફાઉન્ટેન, રોબોટિક્સ ગેલેરી, એક્વાટીક ગેલેરી, પ્લેનેટ અર્થ અને લાઈફ સાયન્સ પાર્ક જેવા આકર્ષણો મુલાકાતીઓને રોમાંચકારી

સહકાર મંત્રી અને ભારતીય જનતા

પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે

બિહારના મુઝફ્ફરપુરમાં એક વિશાળ રેલીને સંબોધિત કરી. આ અવસર પર ભારતીય રાજનીતિના

ચાણકથ અમિત શાહે બિહાર સરકાર

દારા કરવામાં આવેલા તાજેતરના

જાતિ સર્વેક્ષણ રિપોર્ટપર ન માત્ર

સવાલો ઉઠાવ્યા પરંતુ રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી વડા લાલુ યાદવ પર પણ નિશાન સાધ્યું. નીતીશ કુમારને

પલટરામ'નો દરજ્જો આપતા શાહે

સ્પષ્ટતા કરી હતી કે, 'બિહારના જાતિ સર્વેક્ષણનો નિર્ણય ભાજપે બિહાર

સરકારમાં ત્યારે લીધો હતો. પરંતુ અમને ખબર ન હતી કે લાલુજીના

બિહારના જાતિ સર્વેક્ષણનો નિર્ણય ભાજપે બિહાર સરકારમાં હતો ત્યારે લીધો હતોઃ શાહ

भारतीय जनता पादी

અમદાવાદ, કેન્દ્રીય ગહુ અને દુબાણમાં નીતીશ કમાર યાદવો અને

મુસ્લિમોની સંખ્યા વધારીને અત્યંત પછાત વર્ગો સાથે અન્યાય કરશે. શાહે

છ મૈયાને પ્રાર્થના પણ કરી કે બિહાર

જંગલ રાજ અને પલટુરામથી મુક્ત થાય. બિહારના લોકોને ખબર પડી

ગઈ છે કે બિહારમાં જાતિ આધારિત

વસ્તી ગણતરીનો અહેવાલ છેતરપિંડી

છે. તુષ્ટિકરણની રાજનીતિ હેઠળ

યાદવો અને મુસ્લિમોની વસ્તીમાં વધારો દર્શાવવામાં આવ્યો છે અને અત્યંત

પછાત સમુદાયોની સંખ્યા ઘણી ઓછી દર્શાવવામાં આવી છે. લાલુ-નીતીશની

જોડીએ અત્યંત પછાત સમાજ સાથે દગો

કર્યો છે. બિહાર સરકારનો આ જાતિ સર્વે તુષ્ટિકરણથી પ્રેરિત છે, તેણે

બિહારના અત્યંત પછાત લોકો સાથે અન્યાય કર્યો છે. (૧૯-૧૦)

સાયન્સ સિટીમાં પ્રવર્તમાન ગેલેરીઝ અને વિવિધ પ્રોજેક્ટસની વિશેષતાઓ તથા તેને વધુ સુવિધા સભર બનાવવા અંગે પણ સમીક્ષા કરી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટીમાં બીજા ફેઇઝ નું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૨૧માં ઉદઘાટન કર્યા બાદ હવે આગામી સમયમાં જે વધુ નવીનતા સભર આકર્ષણો ઊભા કરવાનું આયોજન છે તેની પણ વિસ્તૃત માહિતી મેળવી હતી. સાયન્સ સિટીમાં હાલના

મ્યઝિકલ ફાઉન્ટેનના અપગ્રેડેશન અને વધુ આકર્ષક બનાવવા સાથે એસ્ટ્રોનોમી એન્ડ સ્પેસ સાયન્સ

ગેલેરીનું નિર્માણકાર્ય અગ્રિમ તબક્કામાં છે. હ્યુમન એન્ડ બાયોલોજીકલ સાયન્સ ગેલેરી તેમજ એવીએશન એન્ડ ડિફેન્સ ગેલેરીનું નિર્માણ અંદાજે કુલ રૂ. ૭૫૦ કરોડના ખર્ચે હાથ ધરવાનું પ્રાથમિક આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સાયન્સ ટાવર અને બાયોડાઇવર્સિટી પાર્કપણ ઊભા કરવામાં આવશે.

આ સમીક્ષા બેઠકમાં પ્રેઝન્ટેશન દરમિયાન જણાવવામાં આવ્યું કે, સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે. ૨૦૧૨ થી ૨૦૨૩ ના દશકમાં અંદાજે ૭૭ લાખ લોકો તેમજ ૨૦૨૨ના એક જ વર્ષમાં ૧૨.૩૯ લાખ લોકોએ સાયન્સ સિટી અનુભવ કરાવે છે. નિહાળ્યું છે. અંદાજે ૪ લાખ જેટલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિદ્યાર્થીઓએ પણ મુલાકાત લીધી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સાયન્સ સિટી જોવા આવનારા મુલાકાતીઓ, વિદ્યાર્થીઓ, વિજ્ઞાન પ્રેમી યુવાઓ પોતાના અનુભવો અને સાયન્સ સિટીની વ્યવસ્થા અંગેના ફીડબેક માટે અદ્યતન કિયોસ્ક, ટ્યસ્કિન કેક્નોલો જ વગેરેને કાર્યરત કરવાનું સૂચન કર્યું હતું. તેમણે સ્વચ્છતા-સફાઈનું સતત ધ્યાન રાખવાની પણ તાકીદ કરી હતી.સાયન્સ સિટીની મુલાકાતે આવનારા લોકો પોતે જોયેલી ગેલેરીઝ અને અન્ય આકર્ષણો અન ૩૫ પોતાના પ્રયોગાત્મક વિચારો, કાર્યો અભિવ્યક્ત કરી શકે

ટેકનોલોજી એક્સપ્લોરેટોરીયમ પણ બનાવવાનું આયોજન છે.

બનાવવાનું આવાજન છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બધા જ વિષયો અંગે સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરીને સમયબદ્ધ આયોજન સાથે નવી ગેલેરીઝ અને પાર્કસના નિર્માણ માર્ગદર્શન માટે માટે માગદર્શન આપ્યુ હતું. મુખ્યમંત્રીશ્રીના અધિક મુખ્યસચિવ શ્રી પંકજ જોપી, સાયન્સ એન્ડેડ ટેકનોલોજી વિભાગના અગ્રસચિવ શ્રી ધનંજય દ્વિવેદી તથા સાયન્સ સિટીના જનરલ મેનેજર શ્રી વદર વગેરે આ સમીક્ષા બેઠકમાં જોડાયા હતા.

ઝોન-II, ઝોન-III, ઝોન-IV અને ઝોન-V. વાસ્તવમાં, ઝોન-ફ માં ઉત્તર-

પર્વીય ભારતનો ભાગ સામેલ છે. જમ્મ

જૂને આસામાં તારા છે. કે ગુ અને કાશ્મીર, લદાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ગુજરાતમાં કચ્છ વિસ્તાર, ઉત્તર બિહારનો કેટલોક ભાગ અને આંદામાન અને નિકોબાર

નો કેટલોક ભાગ આ ઝોન હેઠળ

## ઉત્તર ભારત કેમ વારંવાર ધ્રૂજે છે ધરતી?..

ત્યારે દિલ્હી અને ઉત્તર ભારતને તેનો સામનો કરવો પડે છે. ભારત

## ૧૦ વર્ષની બાળકીનું હાર્ટ-એટેકથી મોતની આશંકા

અમદાવાદ, ભરૂચના વાલિયામાં ૧૦ વર્ષીય બાળકીને હાર્ટ-એટેકથી મોત થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. બાળકીના મોતને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે, જોકે મોતનું સાચું કારણ તબીબી રિપોર્ટ આવ્યા બાદ જ જાણી શકાશે. અંકલેશ્વરમાં ત્રણથી વધ્ લોકોને હાર્ટ-એટેક આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચના વાલિયા તાલુકાની હરિનગર સોસાયટીમાં રહેતી ૧૦ વર્ષીય બાળકી અંકલેશ્વરની ખાનગી સ્કૂલમાં ધોરણ-૪માં અભ્યાસ કરે છે. બાળકીની ગઈકાલે રાતે તબિયત લથડતાં તેને ગેસ્ટ્રોની અસરની સારવાર માટે પરિવારજનોએ અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે દાખલ કરી હતી, જ્યાં તેનું ગેસ્ટ્રોની અસરની સારવાર દરમિયાન મોત નીપજયું હતું. ૧૦ વર્ષની બાળકીનું મોત નીપજતાં પરિવારમાં શોકનો માહોલ ફેલાઈ ગયો છે. બાળાનું હાર્ટ-એટેકથી મોત નીપજ્યું હોવાની આશંકા સેવાઇ રહી છે. જોકે તબીબી

## નેક્સસ અમદાવાદ વન તેના સસ્ટેનેબલ ફેસ્ટિવ કેમ્પેનની જાહેરાત કરે છે કાગળની થેલીઓ,જૂના અખબારો



અમદાવાદ, વિશ્વ વધતા જતા કાર્બન ફૂટપ્રિન્ટને કારણે ઊભા થતા પડકારોનો સામનો કરી રહ્યું છે ત્યારે, ભારતનું સૌથી મોટા રિટેલ પ્લેટફોર્મ નેક્સસ સિલેક્ટ ટ્રસ્ટ, સહુ ટકી શકે તેવા સસ્ટેનેબલ વિકાસ માટે પોતાની પ્રતિબદ્ધતા પર અટલ છે. પર્યાવરણને અનુકૂળ પસંદગીઓ કરવા અને અન્ય લોકોને પણ તે માટે પ્રોત્સાહિત કરવાના વચનને વધુ મજબુત બનાવતા, ભારતના સૌથી મોટા મોલના માલિક અને સંચાલનકર્તાએ સમગ્ર દેશમાંથી લોકોને આગળ આવવા અને પેકેજિંગ કચરો.

વગેરેનું દાન કરવા માટે એક નવીન સસ્ટેનેબલ થીમ આધારિત દિવાળી ઝુંબેશ શરૂ કરી છે. ઝુંબેશની ખાસિયત એ છે કે તેમના મોટા ભાગના મોલમાં દિવાળીના જે ઈન્સ્ટોલેશન્સ છે તે મોટા ભાગે રિસાયકલ કરેલા કાગળ અને કાર્ડબોર્ડની શીટ્સમાંથી બનાવવામાં આવ્યા છે. આ તહેવારોની સિઝનમાં, નેક્સસ અમદાવાદ વને , દરેક વસ્તુમાં ટકાઉપણું, વિવિધતા અને સહુ સાથેનું જોડાણ પસંદ કરીને અને તેમના પરિસરમાં ઈન્ડિયા ગેટનું પુનઃનિમણિ કરીને ઉજવણીની પુન:iનમાણ કરાન ઉજવણાના ભાવનાને કરીથી વ્યાખ્યાયિત કરી છે. આ તહેવારોની સિઝનને ધ્યાન માં રાખીને , તેઓએ ૧૫ ઓક્ટોબરથી ૧૦,૦૦૦ થી વધુની ખરીદી કરનારા ગ્રાહકો માટે ખાતરીપૂર્વકના ઈનામોની જાહેરાત કરી છે. -

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVI. LID. and Printed at: "Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVI. LID. 201, 202, 208 Mandar complex opp mithakhali ry crossing, mithakhali, ahmedabad. Editor: "Mayur C.

## આટલા બધા આંચકા શા માટે અનુભવાય છે? ચાર ઝોનમાં વહેંચાયેલું હતું.. જે વિષે જણાવીએ, ભારત ચાર સિસ્મિક ઝોનમાં વિભાજિત થયેલ છે, જેમ કે

નવીદિલ્હી, શુક્રવારે રાત્રે ૧૧ઃ૩૨ કલાકે દિલ્હી-દ્રઝઇ સહિત સમગ્ર ઉત્તર ભારત મજબૂત ભૂકંપથી હચમચી ગયું હતું. આ ભૂકંપની તીવ્રતા દ.૪ હતી અને તેનું કેન્દ્ર નેપાળમાં હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. દ.૪ની તીવ્રતાના આ ભૂકંપની ઊંડાઈ ૧૦ કિલોમીટર હતી. છેલ્લા કેટલાક મહિનામાં દિલ્હી દ્રઝઇ સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ભૂકંપના અનેક આંચકા અનુભવાયા છે. આવી સ્થિતિમાં. સૌથી મોટો અને મહત્વનો પ્રશ્ન એ છે કે ઉત્તર ભારતની ધરતી વારંવાર કેમ ધ્રૂજે છે અને અહીં ભકંપના આટલા આંચકા શા માટે ાકુક રાત ગાલવા ગામકા સાંગાન મનુભવાય છે? તમને જણાવી દઈએ દિલ્હી-દ્રઝઇ અને સમગ્ર ઉત્તર ભારતમાં વારંવાર ભૂકંપ આવે છે કારણ કે આ ભૂકંપ ઝોનેંફ માં આવે છે. ભૂકંપનું જોખમ ઝોનેંફ અને ઝોન-ફમાં સૌથી વધુ છે... તમને જણાવી ર કે તે વિશાળ ટેક્ટોનિક પ્લેટની સરહદ પર સ્થિત હોવાને કારણે, ઉત્તર ભારતથી ઉત્તર-પૂર્વ ભારત સુધી વિસ્તરેલા હિમાલયના ક્ષેત્રમાં વારંવાર ભૂકંપ આવે છે. આ પ્લેટોના અથડામણથી ભારત અને નેપાળ બંનેમાં ભારંપ આવે છે. નેપાળ અને હિમાલયના ક્ષેત્રમાં જ્યારે પણ ભૂકંપ આવે છે

રિપોર્ટ બાદ જ મોતનું સાચું કારણ જાણી શકાશે.

## AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિ

અમદાવાદ, ડેડીયાપાડા AAPના

ધારાસભ્ય વિરૂદ્ધ નોંધાય ફરિયાદ होरेस्ट विलागे यैतर वसावा વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ ફોરેસ્ટની જમીન પર ખેડાણ અંગે થઈ હતી બોલાચાલી જિલ્લા ભાજપ પ્રમખ યાલાયાલા જિલ્લા ખાજપ પ્રમુખ ધનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે થયેલી બોલાચાલી મામલે પોલીસ ફરિયાદ નોંધાય છે, ત્યારે નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે પ્રતિક્રિયા આપી હતી. નર્મદા જિલ્લાના ડેડીયાપાડાના આમ આદમી บเว็สเ ยเวเมตะน จิสว ฉมเฉเ વિરુદ્ધ નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફોરેસ્ટની જમીન પર ખેડાણ બાબતે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ સાથે બોલાચાલી થઈ હતી. ત્યારે આ મામલે કલમ

જિલ્લા નર્મદા ડેડીયાપ ડડાવાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની સંકુતલા વસાવા, પીએ જીતેન્દ્ર સહિત અન્ય એક ખેડૂત વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

૩૮૬ હેઠળ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ગુન્હો નોંધવામાં આવ્યો છે. વન વિભાગ દ્વારા નર્મદા પોલીસમાં ફરિયાદ નોંધપવામાં આવી છે, જે

ADF એડીએફ કૂડ્સ લિમિટેડ

પની અધિનિયમ, 2013 ("અધિનિયમ"), કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રે 014 ("નિયમો") ના નિયમ 20 અને 22 ની કલમ 108 અને 110 અને અન્ય લાગ સૂચના આથી આપવામાં આવી છે. અદિનિયમ અને નિયમો, સામાન્ય પરિપત્ર 10 તારીખ 8મી એપ્રિલ, 2020 અને 17/2020 તારીખ 13મી એપ્રિલ, 2020, અ . બંધિત પરિપત્રો સાથે વાંચો, જેમાં 28મી ડિસેમ્બર, 2022ના સા સંબંહિત પરિપાસને સાથે વાંચો, હંમાં રાક્ષ્મી ક્લેમ્બર, 2022ના સામાન્ય પરિપાસ 1,70022 અ સામાન્ય પરિપાસ 1,6002023 તાલીપ કરાયો સપ્ટેન્સર, 2023, કોંચીફ બાળનોના પ્રાંક્ષણ ('MCA પરિપાસ'), સિલ્કોરિટીડા એન્ટ એક્સ્ટોન્સ ખોર્ડ ઓફ ઇન્ટિસા (''Stear') (લિસ્ટિં-ઓલ્ટિસોલાન અને કિસ્સ્લોઝર વફરીશાતો) કેંચુલેલના, 2015 (' લિસ્ટિંગ કેંચુલેલના'' સેક્ટિટીયલ સ્ટાન્ડરે આન બત્તરના મીડિંગ્સ ('ક્ટર') ઇન્ટિસ્ટિયું છોફ ઇન્ડની સેક્ટિટીડા ઓફ ઇન્ટિંગ્સ કુલા જરી કરવામાં આવે છે અને અના લાગુ કાશદ, નિસમો અને વિનિયમો લોકોપાડ ઓક્ટોબાફ 2023ની પોસ્ટલ બેલેટ નોટિસમાં નિર્ધારિત હવાવો માટે ઇન્ડીટિંગ પ્રક્રિયા ક્રો

સાઇટ્સ પરથી તેને ડાઉનલોડ કરી શકે છે.

પોસ્ટલ બેલેટ નોટિસમાં ઉલ્લેખિત દસ્તાવેજો ઇલેક્ટોનિક રીતે નિરીક્ષણ માટે ઉપલ છે અને આવા દસ્તાવેજોનં નિરીક્ષણ કરવા માંગતા સભ્યો co. secretary@adf-fu પર કંપનીને ઈ-મેલ મોકલી શકે છે.

પાર્ટ કંપનીને ઇનેલ મોકાવી લોક છે. ઈ-વોર્ટિંગ માટેની ચૂંધનાઓ-એમસીએના પરિપાગો અનુસાર કંપની તેના સત્યોને માત્ર ઇતિક્રદ્વીનિક માશ્રમો (ઇ-વોર્ડિંગ) દ્વારા આ પોસ્ટલ બેલેટ નોર્ટિસમાં સૂચિત દરાવો પર મત આપવાના નોમાના અધિકારની ઉપયોગ કરવાની ચૂર્વિયા પૂર્વી પાર્ટી સે ત્યાંઓની સોની અથવા અમોનિની સંચાર માટે કૂરશ્ર ઇ-વોર્ડિંગ પ્રવિદ્યા દ્વારા જ હતો. હમતીએ વેડોંગ્રિંગ સુધી પાર્ટ્ડ પાડલા માટે એલ્પની તરીકે લિંક ઇન્ટલઇનની સેવાઓ રોકી છે. નીચે દર્શાવેલ સમયગાળા

દરામચાન સભ્યો તેમના મત આપી શકે છે: ઇ-વીકિંગની શરૂઆત: ખુલાય, કમી નવેમ્બર, 2023ના ગેલ સવારે 09.00 વાગ્યે (દર્શ), ઇ-વીકિંગ સમાર, ગુલ્યાટ, ગારી ક્લિએપર, 2023ના ગેલ 05.00 p.m. (ST) ઉપરોક્ત તારીય અને સમય પાર્થી ઇ-વીકિંગની પ્રસૂરી આપવામાં આવશે નહીં અને ઇ-વીકિંગ મોક્યુલ ઉપરોક્ત સમયગાળાની સમાપ્તિ પર વિંક ઈન્દાઇમ દ્વારા તરત જ અક્ષમ કરવામાં આવશે.

થળ : મુંબઈ

વોર્ટિંગ મોક્યુલ ઉપરોશ્વેલ સમાચાળાની સમાપિત પર દિલ ઇન્ટાઇમ દ્વારા તરત જ બહ્નમ કરવામાં આવશે. કેરિંગ મોકમાં શેર ધરાવતા શરહો દ્વારા ઇ-વોર્ટિંગ કરવાની કીત, ફિલ્ડિંકલ મેઠ પોસ્ટલ કેરિંગ મોકમાં શેર ધરાવતા શરહો દ્વારા ઇ-વોર્ટિંગ કરવાની કીત, ફિલ્ડિંકલ મેઠ પોસ્ટલ કેરિંગ કર્યા કેર્સ કર્યા કેર્સ કર્યા કેરિલા કુપ્ત કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા કર્યા મત્ત તે પાયોગ કરતા પહેલા કૃપ્ત કર્યા કરવા કર્યા કર્યા

(ઓરદાંગામ, now...), you'd aoo 083 દેવિણોન: (022) 4918 6270, 9940. (048) લીકોલી (સેરક,), you'd aoo 083 દેવિણોન: (022) 4918 6270, 9940. (048) લીકોલી (સેરક,), you'd ao vu'da's કર્યું નથી, તેઓ તેમના મીર્ગ કેએક કર્યા સાથ તેઓ તેમના કીંગ કેએક કર્યા સાથ તેઓ તેમના કીંગ કેએક કર્યા તેઓ મુંત્ર કરવામાં આવે તો, ઈ-વોર્ટિંગની છેલ્લી તારીએ એટલે કે મંગળવાર, 7મી કિસેપ્સ, 2023ના રોજ પવાર રહ્યા કોંચાનું માનવામાં આવશે. ઈ-વોર્ટિંગના વિશાસો પૂચાવાય, 7મી કિસેપ્સ, 2023ના રોજ પવાર રહ્યા કોંચાનું માનવામાં આવશે. ઈ-વોર્ટિંગના વિશાસો પૂચાવાય, 7મી કિસેપ્સ, 2023ના રોજ પવાર રહ્યા કોંચાનું માનવામાં આવશે. ઈ-વોર્ટિંગના વિશાસો વિશાસો વિશાસો કર્યા કોંચાનું માનવામાં આવશે. ઉપલોધ કેમ કેચાની વિશાસો છે અપ્તામ કર્યા કોંચાનું માનવામાં આવશે. ઉપલેધ કેચાને કોંચાના કેચાને કર્યા કેચાને કર્યા કેચાને કેચાને કેચાને કર્યા કેચાને કર્યા કેચાને કર્યા કર્યા કર્યાનો કેચાને કેચાને કર્યા કર્યા

કોઈપણ પ્રશ્નો/ફરિયાદોના કિસ્સામાં, તમે www.in કાર્યપાત્ર મહ્યાપુત્રાન્ટલાકાના કરતામાત, તમ www.instavotca.inkintime.co.in (સંદાય વિભાગ કેલ્લા) પર વિપાલવા કર્માટલ અંગો instavote ને નીટિંગોને મહું અથતો સંદાર્ભ હાર્ય શકો છો અથવા શ્રી રાજુલ વેજન, મદદનીલ ઉપપાયુખ - ઈ-નીટિંગનો સંપર્ક કરી રાશો છો. સિંદ ઇનાશોમ ઇન્ટિંગા પ્રાપંત્રિટ (સિમિટ) સુધીના એડીએફ ફૂસ્સ લિમિટેડ), સી-101, 247 પાર્ક, એલ.બી.એસ. માર્ગ, વિક્રોલી (વેસ્ટ), મુંબઈ - 400 083, ભારત, ઈ-મેલ:

> બોર્ડ ઓક ડિરેક્ટર્સન ADF ફૂડ્સ લિડિ Sd, શલાકા ઓવલેકર, કંપનીના અગિ

હતી. જ

NOTICE is hereby given that the below mentioned Sub Broker / Authorised Person is no longer at as Sub Broker / Authorised Person of Kotak Securities Limited.					
Sub Broker/ Authorised Person Name			Address of Sub Broker/ Authorised Person		
Hariyali Pankajbhai Gosai	Hariyali Pankajbhai Gosai	1405 - 14 020 1000001	D 501 Satyam Skyline Opp Torrent Zonal Office Naranpura Ahmedaba Naranpura Vistar Ahmedabad 380		
Any person hence Ltd. shall not be are requested to it shall be deeme	ceforth dealing liable for any s inform Kotak S d that there ex	with above mention SB/AP sh uch dealing. In case of any q Securities Ltd. within 15 days t ists no queries against the abo	ould do so, at their own risk. Kotak Se ueries for the transactions till date, In- from the date of this notification, failing ove mentioned SB/AP.		
	as Sub Broker / / Sub Broker / Authorised Person Name Hariyali Pankajbhai Gosai Please note that Any person hene Ltd. shall not be are requested to it shall be deeme	as Sub Broker / Authorised Pers Sub Broker / Trade Name Name Hariyali Pankajbhai Pankajbhai Gosai Gosai Please note that above mentior Any person henceforth dealing Ld. shall not be liable for any are requested to inform Kotak cit shall be deemed that there we	as Sub Broker / Aufforised Person of Kotak Securities Limite           Sub Broker / Authorised Person Name         Trade Registration Numbers of Sub Broker / Authorised Person Name           Hariyal Pankajohai         Hariyal NSE - AP0291560931           Pankajohai         Pankajohai		

### સાંકેતિક કબ્જા નોટીસ

ficici Bank રોડને ૧ પ્લોટ નેન્ બી ૩ વાઈકાઈ આઈટી પાર્ક, વાગલે ઈન્ડસ્ટીયલ એસ્ટેટ,થાક્ષે, મહા

આપી સિધ્યુડાઈડોશન દિલ્ફુદ્રકાન કાઇનાન્સ એસેટ એન્ડ ઇનકોર્સ્સમેન્ટ ઓફ સિક્યુડિટી ઓફ ઇન્ટરેસ્ટ એક્ટ, 2002 અને સિક્યુડિટી ઇન્ટરેસ્ટ ઇન્ફ્રિયનેન્ટ 2002ની કહ્ય ૧૩ (૧૩) તેની સાથે અનુષ્ઠેક 5 સાથે વાંચના મળેલી સત્તાની રૂએ (દીવાન હાઉસિંગ ફાયનાન્સ લી. હારા આદીસીઆઇસીઆઈના નિમ્પયેલા નીધે સાહિ કરનાર અધિવારીએ) સિક્યુડિટી ઓફ એન્ફ્રોસીન્ટ ના સંબંધમાં ડીએએકએન્ટ અને દરજદારો વચ્ચે લોન ખાબત થયેલા કરાવના આપદે હાઉસિંગ લોન ની સગવડ મેળવી છે, તેઓ જે લોન મેળવી છે, તેની મૂળ ૨૬મ અને વ્યાજની ચુકવરીયો તેઓ જે પ્લાન મેળવી છે, તેની મૂળ ૨૬મ અને વ્યાજની ચુકવરીયો તેઓ જે પ્લાન મેળવી છે, તેની મૂળ ૨૬મ અને વ્યાજની ચુકવરીયો તેઓ તેઓ જે આ પ્લાન સ્થાન પ્લાન કર્યા નામ વ્યવસાર આ આ પ્લાન મેળ લી કર્યા કર્યા કર્યા માન્ય જનતાએ શીઈ પણ પ્રકારનો વ્યવસાર કરવો નહીં.

	ક્રમ નં.	કરજદારોનું નામ / (લોન એકાઉન્ટ નંબર) (ડીએચએકએલ જુનો એલએએન અને આઈસીઆઈસીઆઈ નવો એલએએન)		ડિમાંડ નોટીસની તારીખ /ડિમાંડ નોટીસની ૨કમ (રૂ)	શાખાનું નામ
	۹.	ઓમપ્રકાશ મિશ્રા અને મંજુ ઓમપ્રકાશ મિશ્રા- ( જુનો ડિએચએફએલ લેન નં ૦૧૮૦૦૦૦૭૮ ૧૪ અને ન્યુ આઈસીઆઈસીઆઈ લેન નં. QZBRD00005035159)	બ્લોક નં ડી-૯૫, પ્રોજેક્ટ સનસિટી રેસીડેન્સી રૉ લાઉસ તરીકે ઓળખાય, તરસાડી કુવરળા, માગરોલ, ફોસ્પમા રેવેન્યુ સર્વે નં ૨૮૧૦એ, ૨૮૫એ લોકેટેડ એટ્ટ કુવરળા રોડ, માંગરોલ, ફોસામ્બા ગુજરાત રજ્યદેશન ડિસ્ટ્રીક્ટ એન્ડ સબ ડિસ્ટ્રીક્ટ માંગરોલ ડિસ્ટ્રીક્ટ - સુરત કોસામ્બા- ૩૯૪૧૨૦./૦૨ નવેમ્બર, ૨૦૨૩.	૨૨ મે. ૨૦૨૩ રૂા. ૮,૧૬,૩૮૯.૦૦/-	ક્રોસામ્બા
ı	ઉપર	. જણાવેલા કરજદાર(રો)/ જામીનદાર(રો) અહીં બાક	ી નાણાં પરત કરી જવા માટે ૩૦ દિવસની નોટીસ આપ	વામાં આવે છે. નહીં તે	ા કલમ ૮ અને

દ્યા કરજદાર(સા) જામાંગદાર(સ) અહાં પાડા પાડા પરંત કરા જેવા માટ ૩૦ ાટપરામાં માટાસ આપવામાં આવે છે. મહા તા કર્યા ટ : ઇન્ટરેસ્ટ (ઇન્ફોર્સમેન્ટ) રૂલ, ૨૦૦૨ની જોગવાઈ મુજબ જામીન તરીકે મુકેલી મિલ્કત આ નોટીસ પ્રસિદ્ધ થયાનાં ૩૦ દિવસ બાદ

ત્વારા આવશ. તારીખ : ૦૮ નવેમ્બર, ૨૦૨૩

### BHATIA'S' BHATIA COMMUNICATIONS & RETAIL (INDIA) LIMITED CIN: L32109GJ2008PLC053336

Regd Off: 132, Dr. Ambedkar Shopping Centre, Ring Ro ebsite: www.bhatiamobile.com, mail: info@bhatiamobile.c

SI. No.	Particulars	Quarter ended 30 <sup>th</sup> September 2023	Half Year ended 30 <sup>th</sup> September 2023	Quarter ended 30 <sup>th</sup> June 2023	Quarter ended 30 <sup>th</sup> September 2022
		(Unaudited)	(Unaudited)	(Unaudited)	(Unaudited)
1	Total Income from Operations*	9435.582	19142.530	9706.948	7354.875
2	Net Profit / (Loss) for the period (before Tax, Exceptional and/or Extraordinary items)	332.545	800.460	467.915	217.720
3	Net Profit / (Loss) for the period before tax (after Exceptional and/or Extraordinary items)	332.545	800.460	467.915	217.720
4	Net Profit / (Loss) for the period after tax (after Exceptional and/or Extraordinary items)	247.335	604.822	357.487	162.804
5	Total Comprehensive Income for the period [Comprising Profit / (Loss) for the period (after tax) and Other Comprehensive Income(after tax)]	247.884	605.921	358.036	163.549
6	Equity Share Capital	1251.520	1251.520	1251.520	1251.520
7	Reserves (excluding Revaluation Reserve) as shown in the Audited/Unaudited Balance Sheet of the previous year	-	-	-	-
8	Earnings Per Share (face value of Re. 1/- each) (for continuing and discontinued operations)	-	-	-	-

ote: . The above is an e

KDIOHNA CAPITAL & SECURITIES LTD.

EXTRACT STANDALONE STATEMENT OF UNAUDITED FINANCIAL RESULTS FOR THE QUARTER AND HALF YEAR EN

PARTICULARS		UARTER END	ED	HALF YEA	YEAR ENDED	
		30/06/2023	30/09/2022	30/09/2023	30/09/2022	31/03/2023
	(Unsudited)	(Unandited)	(Unaudited)	(Unaudited)	(Unandited)	(Audited)
MONTH COVERED	3	3	3	6	6	12
Total Income From Operating Income	10.11	8.59	8.69	18.70	19.62	39.11
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.67	1.31	4.33	5.96	5.46	16.64
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	4,67	1.31	4.33	5.98	5.46	16.64
Net Profit/(Loss) for the Period After Tax	3.51	0.98	3.25	4.49	4.10	14.04
Total Comprehensive Income For the Period (Comprehensive Profit/(Loss) for the period (after Tax) and Other Comprehensive Income (After Tax)	3.51	0.98	3.25	4.49	4.10	14.04
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.11	0.03	0.10	0.14	0.13	0.44
Diluted Earning Per Share (EPS) in Rapees after Exceptional Item	0.11	0.63	0.10	0.14	0.13	0.44

		UARTER END		HALF YES	YEAR ENDED	
PARTICULARS		30/06/2023	30/09/2022	30/09/2023	30/09/2022	31/03/2023
		(Unsudited)	(Unsudited)	(Unsudited)	(Unsudited)	(Audited)
MONTH COVERED	3	3	3	6	6	12
Total Income From Operating Income	10.11	8.59	8.69	18.70	19.62	39.11
Net Profit/(Loss) for the Period (Before Tax and Exceptional Item)	4.67	1.31	4.33	5.98	5.46	16.64
Net Profit/(Loss) for the Period (Before Tax and After Exceptional Item)	2.64	1.16	4,44	3.80	4.69	17.58
Net Profit/(Loss) for the Period After Tux	1.98	0.87	3.33	2.85	3.52	14.83
Total Comprehensives Income For the Period (Comprehensing Profit/(Loss) for the period (after Tux) and Other Comprehensive Income (After Tux)	1.98	0.87	3.33	2.85	3.52	14.83
Paid up Equity Share Capital (Face value Rs. 10/- Per Shares)	315.84	315.84	315.84	315.84	315.84	315.84
Basic Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.06	0.03	0.11	0.09	0.11	0.47
Diluted Earning Per Share (EPS) in Rupees after Exceptional Item	0.06	0.03	0.11	0.09	0.11	0.47